

ફો.પ.અ.નં.૨૦૫/૨૦૨૬ ના કામે અરજદાર માલદેભાઈ અરજનભાઈ નંદાણીયાનાઓની બેંકમાં ફીઝ થયેલ રકમ મુક્ત/રિફંડ કરવા માટે બી.એન.એસ.એસ. ની કલમ - ૪૯૭, ૫૦૩ ની અરજી લગત હુકમ

(૧) હાલની અરજી અરજદાર માલદેભાઈ અરજનભાઈ નંદાણીયાનાઓએ સાયબર ક્રાઈમ પોલીસમાં State Bank of India બેન્કના ખાતા નં./ક્રેડિટ કાર્ડ નં.૬૬૦૦૬૧૫૫૮૮૮ માંથી કુલ રૂ.૫૦,૦૦૦/- ઉપડી ગયેલ હતા જે બાબતે તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નં. ૧૯૩૦ ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવેલ હતી. ત્યાર બાદ ફરિયાદની રકમ બાબતે સાઈબર ક્રાઈમ દ્વારા સામાવાળાનાઓના નીચે જણાવ્યા મુજબના ખાતાઓ બી.એન.એસ.એસ.ની કલમ-૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા.

ક્રમ નં.	બેંકનું નામ	ખાતા નં.	રકમ રૂ.
1.	Jio Payment Bank Ltd.	001521711575247	50,000/-

આમ, ઉપર જણાવ્યા મુજબનાં બેંક ખાતામાં હાલ સુધી બેંકમાં જેમના તેમ પડી રહેલ છે અને અરજદારને પરત મળેલ નથી. સદર ગુન્હા બાબતે એફ.આઈ.આર. થયેલ નથી. જેથી અરજદારને આર્થિક નુકશાન થયેલ છે. જેથી અરજદારે ઉપરોક્ત રકમ મેળવવા હાલની અરજી કરેલ છે. અરજદાર તરીકે તેઓની અરજીના સમર્થનમાં ઓળખનો પુરાવો અને પાસબુક તથા બેંક સ્ટેટમેન્ટ તથા લાઈટ બિલ રજૂ કરેલ છે.

(૨) સદર અરજી આવતા તપાસ કરનાર અમલદારને અભિપ્રાય રજૂ કરવા યાદી કરેલ. તપાસ કરનાર અધિકારીએ અરજદારની ફરિયાદના અધારે સાયબર ક્રાઈમ સેલ સી.આઈ.ડી. દ્વારા અરજદારના ઉપરોક્ત ખાતામાંથી ગયેલ નાણાં પૈકી સામાવાળાનો શંકાસ્પદ ખાતામાં કુલ

રકમ રૂ.૫૦,૦૦૦/- બી.એન.એસ.એસ. ની કલમ-૧૦૬ મુજબ ફીઝ કરાવેલ છે. તેમજ સદર બેંક ખાતા શંકાસ્પદ હોવાનું જણાઈ આવેલ છે અને સદરહું ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર કે અન્ય કોઈ વ્યક્તિ સીઝ કર્યા બાબત તેમના સમક્ષ પોલીસમાં કોઈ વાંધા તકરાર જણાવેલ નથી, જેથી તે રૂપિયા અરજદારને પાછા આપવા અભિપ્રાય આપેલ છે.

(૩) અરજદર તરફે તેઓના વિ.વ.શ્રી દ્વારા તેઓની અરજી પ્રમાણે દલીલ કરવામાં આવેલ હોય પુનરાવર્તન કરવામાં આવેલ નથી. જ્યારે વિ.એ.પી.પી.શ્રી દ્વારા મુદ્દામાલ અરજી ગ્રાન્ટ કરવામાં આવે તો કોઈ વાંધો ન હોવાનો શેરો કરેલ છે.

(૪) સદરહું મુદ્દામાલ રકમ સંબંધે અરજદાર સિવાય અન્ય કોઈ કલેઈમ કરેલ નથી. તેમજ મુદ્દામાલ રોકડ રકમ છે, જો વધુ સમય બિનવપરાશી બેંક ખાતામાં પડી રહે તો અરજદારને આર્થિક નુકશાની સહન કરવી પડે તેમ છે. સદરહું ગુન્હા બાબતે એફ.આઈ.આર. નોંધાયેલ નથી. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય વંચાણે લેતાં અરજદારની રકમ સામાવાળાનાં ખાતામાં ફીઝ થયેલ છે. જેથી મુદ્દામાલ રોકડ રકમ નીચેની શરતોને આધિન અરજદારને સોંપવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાય તેમ છે, આથી નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

-:: હુકમ ::-

- અરજદારની અરજી આથી મંજૂર કરવામાં આવે છે.
- તપાસ કરનાર અમલદારે અરજદારની ફરિયાદના કામે ફીઝ કરવામાં આવેલ રકમ રૂ.૫૦,૦૦૦/- છે તે ફીઝ થયેલ રકમની દોઢી રકમ પુરાના જામીન તથા તેટલી જ રકમના બોન્ડ સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજુ કર્યેથી અરજદારના State Bank of India બેન્કના ખાતા નં./ક્રેડિટ કાર્ડ નં.૬૬૦૦૬૧૫૫૮૮૮ માં જમા કરાવવી.

—:: શરતો ::—

- અરજદારે મુદ્દામાલ રોકડ રકમ તપાસ કરનાર અમલદાર જયારે ફરમાવે ત્યારે સંબંધિત પો.સ્ટે.માં રજુ રાખવાની રહેશે.
- હુકમની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનને યાદી કરવી.

સદરહુ હુકમ આજરોજ તારીખ:૦૧, માહે:ઓગષ્ટ,
સને:૨૦૨૬ ના રોજ ખુદી અદાલતમાં વાંચી સંભળાવી મારી સહી
કરીને જાહેર કર્યો.

તારીખ: ૦૧/૦૮/૨૦૨૬.
મુકામ: ઉપલેટા.

(પી.પી.કાલા)
જયુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ,
ઉપલેટા.
UIC-GJ01761